

ઇગ્નાઇટ 2.0માં રજૂ થયા વિવિધ પ્રોજેક્ટ્સ

અમદાવાદ: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા ગુરુવારે ઇગ્નાઇટ 2.0નું આયોજન થયું હતું. જેમાં શૂટઆઉટ વીથ લેસર ગન્સ, રોબોટ કાર રેસિંગ જેવી ગેમ્સ, પાણી પર સ્ટર્ક્યર ઊભા કરવાની સ્પર્ધાથી લઇને વર્ટિકલ એક્સસી વીન્ડ ટર્બાઇન, ડીઝલમાંથી હાઇડ્રોજન કેવી રીતે પેદા કરવું જેવા હાર્ડકોર સાયન્સ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીએ રજૂ કર્યા હતા. આ અંગે આઇઆઇટી ગાંધીનગરના સ્ટુડન્ટ એન્ડ ટેકનિકલ સેક્રેટરી અમિનવ સિંઘે જણાવ્યું હતું કે, 'વિદ્યાર્થીઓમાં ટેકનિકલ કલ્ચરનો પ્રસાર કરવા માટે ઇગ્નાઇટ 2.0નું આયોજન કરાય છે.